

August 16, 2019

To

1. The Manager, Corporate Relationship Dept., BSE LIMITED, Phiroze Jeejeebhoy Towers, Dalal Street. MUMBAI - 400 001

Script Code: 526725

#### E-FILING

2. The Manager, Listing Department, NATIONAL STOCK EXCHANGE OF INDIA LTD., "Exchange Plaza", C-1, Block-"G", Bandra-Kurla Complex, Bandra (E), MUMBAI - 400 051

NSE Symbol: SANDESH (EQ.)

Dear Sir / Madam,

#### Sub: Intimation to Stock Exchange regarding Publication of Financial Results in Newspaper

Pursuant to Regulation 30 and 47(3) read with Schedule III of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the copies of newspaper advertisement published on August 15, 2019, of the newspapers "Financial Express" (English Newspaper) and "Sandesh" (Gujarati Newspaper), regarding publishing of the Standalone and Consolidated Un-Audited Financial Results of the Company for the Quarter ended on June 30, 2019 which were considered, approved and taken on record by the Board of Directors, in their meeting held on August 14, 2019.

Further, in terms of Regulation 46 of the Listing Regulations, the aforesaid financial results are also uploaded on the website of the Company (www.sandesh.com).

Kindly take the same on your records.

Thanking you,

Yours sincerely,

FOR, THE SANDESH LIMITED

DHAVAL PANDYA

COMPANY SECRETARY

Encl: As above



#### રિષભ પંત હવે બેટિંગમાં અખતરા કરવાનું બંધ કરશે

ભારતીય વિકેટકીપર રિષભ પંત હવે બેટિંગમાં અખતરા કરવાનું બંધ કરીને પરિપક્વ ખેલાડી બનવાનો પ્રયાસ કરશે. પંતે જણાવ્યું હતું કે પ્રત્યેક મેચ મારા માટે મહત્ત્વપૂર્ણ છે અને આ માત્ર આગામી છ મહિનાનો મામલો નથી. ક્રિકેટ કારકિર્દીમાં પ્રત્યેક દિવસ મહત્ત્વનો હોય છે. ક્રિઝ ઉપર ઊતરું છું તો મારું ધ્યાન આ બાબત પર હોતું નથી. ક્રિઝ ઉપર સ્થાયી થયા બાદ હું બિનજવાબદાર શોટ્સ રમીને

મારી વિકેટ ફેંકી દઉં છું.

# Sports

જુતૈદખાને પાક. બોર્ડ ઉપર પક્ષપાતનો આક્ષેપ કર્યો

પાકિસ્તાનના પેસ બોલર જુનેંદ ખાનને વર્લ્ડ ક્ય પહેલાં ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સમચે તે મોંઢા ઉપર કાળી ટેપ લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેણે આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કર્યો હતો. આ કારણથી એવી અટકળો કરવામાં આવી હતી કે પાકિસ્તાન ટીમમાં તનાવભર્યું વાતાવરણ છે. પસંદગીકારો સામે પક્ષપાત કરવાનો આક્ષેપ કરીને જુનેંદે જણાવ્યું હતું કે સારો દેખાવ હોવા છતાં મને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો.



THURSDAY, 15 • 08 • 2019

#### **AHMEDABAD**

#### **न्यू**ज जिट्स

#### યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં સ્ટોસુર અને ગોફને વાઇલ્ડ કાર્ડ

ન્યૂયોર્ક | ભૂતપૂર્વ ચેમ્પિયન સમાન્થા સ્ટોસુર અને વિમ્બલ્ડનમાં શાનદાર પ્રદર્શન કરનાર કોકો ગોફને વર્ષના છેલ્લા ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપનમાં વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યું છે. ૧૫ વષીય ગોફે ક્વોલિફાઇંગ મુકાબલા દ્વારા વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવ્યું હતું અને તેને પ્રથમ રાઉન્ડમાં અમેરિકાની અનુભવી ખેલાડી વિનસ વિલિયમ્સને પરાજય આપ્યો હતો. જોકે તે ચોથા રાઉન્ડમાં સિમોના હાલેપ સામે હારી ગઈ હતી. ગોફ ઉપરાંત આઠ વાઇલ્ડ કાર્ડથી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરનાર ખેલાડીઓમાં ચાર બીજી યુવા ખેલાડીઓ છે જેમાં અમેરિકાની ૧૭ વર્ષીય ત્રણ ખેલાડી કેટી મેકનેલી, વ્હિટની ઓસિગ્વે તથા કેટી વોલિનેટ્સ તથા ફ્રાન્સની ૧૬ વર્ષીય ડાયને પેરીનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાની ૩૫ વર્ષીય તથા ૨૦૧૧ની ચેમ્પિયન સ્ટોસુરને પણ વાઇલ્ડ કાર્ડ આપવામાં આવ્યું છે. મેન્સ ઇવેન્ટમાં અમેરિકાના માર્કોસ ગિરોન, ડેનિસ, કુડલા, જૈક સોક તથા અર્નેસ્ટો એસ્કોબેડાને પણ વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ આપવામાં આવ્યો છે.

#### ઇંગ્લેન્ડને હરાવી ભારતે ફિઝિક્લી હેન્ડિકેપ વર્લ્ડ ટી૨૦ શ્રેણી જીતી



મુંબઈ l પ્રબળ દાવેદાર ભારતે ફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડને ૩૬ રનથી હરાવીને પ્રારંભિક ટી૨૦ શારીરિક વિકલાંગતા વર્લ્ડ શ્રેણીનું ટાઇટલ જીતી લીધું હતું. બ્લેકફિંચ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૮૦ રન બનાવ્યા હતા. ત્યારબાદ ઈંગ્લેન્ડને નવ વિકેટે ૧૪૪ રનના સ્કોર સુધી સીમિત રાખીને ટ્રોફી જીતી લીધી હતી. મધ્યમ હરોળના બેટ્સમેન જે સાંતેએ ૩૪ બોલમાં ૫૩ રન બનાવ્યા હતા. બીસીસીઆઇએ ટીમને માન્યતા આપી છે પરંતુ તેને કોઇ નાણાકીય મદદ કરી નથી. બીસીસીઆઇએ ટ્વિટર ઉપર ટીમને અભિનંદન આપ્યા હતા. ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે પણ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ભારતે સેમિફાઇનલમાં પરંપરાગત હરીફ પાકિસ્તાનને આઠ વિકેટે કારમો પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

#### દ.આફ્રિકન ટી૨૦ ટીમમાંથી સ્ટેઇનની બાદબાકી, વિરાટ કોહલીની માફી માગી

ું જોહાનિસબર્ગ I સાઉથ આફ્રિકનના સ્ટાર પેસ બોલર ડેલ



સ્ટેઇને ભારતના પ્રવાસમાં રમાનારી ત્રણ મેચોની ટી૨૦ શ્રેણી માટેની ટીમમાં પસંદગી નહીં થવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મંગળવારે ટ્વેન્ટી૨૦ ટીમની જાહેરાત કરી હતી અને આ ટીમનું

નેતૃત્વ ક્વિન્ટન ડી કોકને સોંપવામાં આવ્યું છે. ત્રણ નવા યહેરા ટેમ્બા બાવુમા, બજોર્ન ફોસ્ટ્યૂન અને એનરિક નોતંઝેને ટીમમાં સ્થાન અપાયું છે. સ્ટેઇને ટ્વિટર ઉપર નિરાશા વ્યક્ત કરીને એક ટ્વિટનો જવાબ આપીને જણાવ્યું હતું કે આફ્રિકન પસંદગીકારો કદાચ મારો નંબર ભૂલી ગયા છે. સ્ટેઇને ટ્વિટર ઉપર ભારતીય સુકાની વિરાટ કોહલી તથા ભારતના લાખો સમર્થકોની પણ માફી માગી હતી. સ્ટેઇને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે પરંતુ તેણે વન-ડે તથા ટ્વેન્ટી ૨૦ ક્રિકેટમાં પોતે ઉપલબ્ધ રહેશે તેવી આફ્રિકન પસંદગીકારોને સ્પષ્ટતા કરી દીધી હતી.

#### સિનસિનાટી ઓપનમાં રોજર ફેડરર અને જોકોવિચ પ્રથમ મેચ જીત્યા



સિનસિનાટી I રોજર ફેડરર અને નોવાક જોકોવિચે સિનસિનાટી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં આસાન વિજય હાંસલ કર્યા હતા. બીજી તરફ પીઠની ઈજાના કારણે અમેરિકાની સેરેના વિલિયમ્સને આ ટૂર્નામેન્ટને પડતી મૂકી હતી. ૨૩ વર્ષીય સેરેનાનું ૨૬મી ઓગસ્ટથી રમાનારા યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં ભાગ લેવું શંકાસ્પદ બન્યું છે. વરસાદના વિઘ્ન વચ્ચે ફેડરરે આર્જેન્ટિનાના જુઆન ઇગ્નેસિયો લોડેરોને દ-૩, દ-૪થી પરાજય આપ્યો હતો. ગયા વર્ષના ચેમ્પિયન જોકોવિચે અમેરિકાના સેમ ક્વેરીને ૭-૫, દ-૧થી તથા સ્ટેનિસ્લાસ વાવરિંકાએ ૨૦૧૭ના ચેમ્પિયન પ્રિગોર ડિમિટ્રોવને ૫-૭, દ-૪, ૭-૬થી હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં વિનસ વિલિયમ્સે કિક બર્ટેન્સને દ-૩, ૩-૬, ૭-૬થી હરાવીને ટૂર્નામેન્ટમાં આગેક્ચ જારી રાખી હતી.

# તોફાની અંદાજમાં ગેઇલની વિદાય, વરસાદનું વિઘ્ન

વરસાદના વિઘ્ન વચ્ચે ભારત અને યજમાન વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં યુનિવર્સલ બોસ તરીકે જાણીતા ઓપનર ક્રિસ ગેઇલે તોફાની અંદાજમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગેઇલના આઉટ થવાની સાથે ભારતીય ટીમના તમામ

આઉટ થવાની સાથે ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ તેને અભિનંદન આપ્યા હતા. ગેઇલે મેદાનની બહાર જતાં પહેલાં પોતાના બેટના હેન્ડલમાં હેલમેટ મૂકીને તેને ઊંચું કરી તમામ પ્રેક્ષકોનો આભાર માન્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને વરસાદના કારણે રમત બંધ રાખવામાં આવી ત્યારે ૨૨ ઓવરમાં બે વિકેટે ૧૫૮ રન બનાવી લીધા હતા. આ સમયે શાઇ હોપ ૧૯ તથા હેતમાયર ૧૮ રને રમી રહ્યા હતા.

ગેઇલે તેની છેલ્લી ઇનિંગ્સમાં તોફાની બેટિંગ કરીને ૪૧ બોલમાં આઠ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર વડે ૭૨ રન બનાવ્યા હતા. તેણે સાથી ઓપનર ઇવિન લુઇસ સાથે પ્રથમ વિકેટે ૧૧૫ રનની ભાગીદારી નોંધાવી હતી. લુઇસે ૨૯ બોલમાં પાંચ બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે ૪૩ રન બનાવ્યા હતા. બંનેએ ૧૦ ઓવરમાં વિન્ડીઝનો સ્કોર ૧૧૪ રન સુધી પહોંચાડી દીધો હતો. ૨૦૧૨

બાદ પ્રથમ ૧૦ ઓવરમાં કોઇ ટીમ તરફથી નોંધાયેલો આ ત્રીજો સૌથી મોટો સ્કોર રહ્યો છે. ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સદી નોંધાવી ચૂકેલા ગેઇલે વેસ્ટ ઇન્ડિઝ માટે ૩૦૧ વન-ડેમાં ૧૦.૪૮૦ રન બનાવ્યા હતા. તેણે વન-ડેમાં ૨૫ સદી તથા ૫૪ અડધી સદી કટકારી હતી.

#### **પ્રે** સ્કોરબોર્ડ વેસ્ટ ઇન્ડિઝ અને બોલ ૪ ફ. ગેઇલ કો. કોહલી બો. ખલીલ ૭૨ ૪૧ ૮ ૫.

હેતમાચર રમતમાં ૧૮ ર૩ ૧ ૦. એક્સ્ટ્રા : ૧૬. કુલ : (૨૨ ઓવરમાં, છે વિકેટે) ૧૫૮. વિકેટ : ૧-૧૧૫ (વુક્સ, ૧૦,૫), ૨-૧૨૧ (ગેઇલ, ૧૧,૪). બોલિંગ : ભુવનેશ્વર કુમાર : ૫-૧-૪૮-૦, મોહમ્મદ શમી : ૩-૧-૩૧-૦, ખલીલ એહમદ : ૪-૦-૪૩-૧, ચુઝવેન્દ્ર ચહલ : ૬-૦-૨૧-૧, કેદાર જાઇવ - ૪-૦-૧૩-૦.

લઇસ કો. ધવન બો. ચહલ 💮 ૪૩ 💮 ૨૯ પ 🔾 ૩

#### વરસાદના કારણે લોર્ડ્ઝ ટેસ્ટનો પ્રથમ દિવસ ધોવાયો લંડન : ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા

વચ્ચે ઐતિહાસિક લોર્ડ્ઝ ખાતેની બીજી ટેસ્ટ મેચોનો પ્રથમ દિવસ ભારે વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. એક સમયે બ્રિટિશ ટાઇમ પ્રમાણે બપોરના લગભગ ૩:૦૦ વાગ્યાની આસપાસ ટોસ થાય તેવી સંભાવના હતી પરંતુ વરસાદે ફરીથી આગમન કરતાં ટોસ સ્થગિત કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં પેસ બોલર જોફા આર્ચરને ઈંગ્લેન્ડની પરંપરાગત ટેસ્ટ કેપ આપવામાં આવી હતી પરંતુ મેદાનમાં તેનું આગમન વિલંબમાં મુકાયું છે. મેચ હવે ચાર દિવસની રમાશે અને પ્રત્યેક દિવસે સમયમાં વધારો કરવામાં આવશે. હવે ફોલોઓન માટે ૧૫૦ રનનો માર્જિન રહેશે. એશિઝમાં છેલ્લે ૨૦૧૩માં ઓવલ ટેસ્ટનો પારંભિક દિવસ વરસાદના કારણે ધોવાઇ ગયો હતો. પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે. પ્રથમ ટેસ્ટના બંને દાવમાં સ્મિથે સદી ફટકારીને ટીમના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

## ગેરવર્તણૂકમાં ફસાયેલા ભારતીય ટીમ મેનેજરને વતન પરત ફરવા આદેશ

નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝમાં ગેરવર્તણૂક મામલામાં



ફસાયેલા ભારતીય ટીમના મેનેજર સુનીલ સુબ્રમણ્યમને વતન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુબ્રમણ્યમને ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટમાં પણ પોતાના ખરાબ વ્યવહારના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે તે બચી ગયા

હતા. બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે હવે તેમને મેનેજર પદની ચૂંટણી લડવા માટે પણ પ્રતિબંધિત કરવામાં આવે તેવી સંભાવના છે. વતન પરત ફર્યા બાદ તે કયા પ્રકારના ખુલાસા કરે છે તેના ઉપર તમામ બાબતનો મદાર રહેશે. તેમની ગેરવર્તણૂક અંગેનો આ પ્રથમ બનાવ નથી. અગાઉ તો આ પ્રકારની વર્તણૂક અંગે અવગણના કરવામાં આવી હતી પરંતુ આ વખતે બીસીસીઆઇએ ગંભીરતાથી બનાવની નોંધ લીધી છે. જો ત્રિનિદાદ એન્ડ ટોબેગો ખાતેના ભારતીય હાઇ કમિશન સાથે આ બનાવ જોડાયેલો ના હોત તો કદાચ તેમને પ્રવાસ પૂરો કરવા દીધો હોત પરંતુ સીઓએના પ્રમુખ વિનોદ રાય સુધી વાત પહોંચી ગઇ હોવાના કારણે કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

# ઈંગ્લિશ,ઓસ્ટ્રેલિયનખેલાડીઓએ ધનંજયની સ્પિન માયાજાળમાં ન્યૂઝીલેન્ડ ફસાયું ભારતીય વ્યંજનોનો સ્વાદ માણ્યો પ્રથમ ટેસ્ટ: ન્યૂઝીલેન્ડ પાંચ વિકેટે ૨૦૩, ટેલર અશનમ ૮૬, ધનંજયની પાંચ વિકેટ

MENU-DAY I

WILD MUGHEROM, CHESTNUT ITHY ME SOUP (1)

E FLEMLY EMPTS BEFOR EALLY

STUFFED LAMB SADDLE

COMMITTED STOME BASS

ELECTION OF ICECLEAM

MENU-DAY TOWNED (1)

ENDSTEAMENT VERLETBELD, THATOS SALVE

CHICKEN LASAGNE

THETITEBANAM VERLETBELD, THATOS SALVE

CHICKEN TIKKA CURLY (V)

DAHL E MIXED VELETABLET (1)

PRAWNS E MARIE ROSE SAUCE

MASHED POTATO, BASMATI LOE, POPADOMS

BABY CARLOTS & CORN, FREACH BEANS

CHILDEN STAND E BOILED ELLS

APPLE PIE E CUSTAPLD

DARK CHOCOLATE & CHERRY CHESTEARS

FRESH FRUIT SALAD

SELECTION OF ICECLEAM

લોર્ડ્ઝ ા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રારંભિક દિવસે લંચ સુધી વરસાદના કારણે રમત શક્ય બની નહોતી અને લંચ વહેલો લેવામાં આવ્યો હતો. ઐતિહાસિક લોર્ડ્ઝ ખાતે બંને ટીમોને કોન્ટિનેન્ટલ વાનગી ઉપરાંત ભારતીય વ્યંજનો પણ પીરસવામાં આવ્યા

હતા. જેમાં ચિકન ટિક્કા, પનીર તથા પતીર ટિક્કા સહિત કેટલીક વાતગીઓ મેતૂમાં મેશ પોટેટો, પાપડ સહિત કેટલીક અન્ય વાનગીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને ટીમોમાંથી ઘણા ખેલાડીઓ ભારતમાં રમાતી આઇપીએલમાં રમતા

પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. બંને ટીમોમાંથી ઘણા ખેલાડીઓ ભારતમાં રમાતી આઇપીએલમાં રમતા હોવાના કારણે તેમને ભારતીય વાનગીઓ વધારે ગમતી હોય છે. આ ઉપરાંત પ્લેયર્સ મેનૂમાં કેટલીક નોન-વેજ વાનગીઓ પણ રાખવામાં આવી હતી.

ગાલે : શ્રીલંકન સ્પિનર અકિલા ધનંજયે પાંચ વિકેટ ઝડપતા ન્યૂઝીલેન્ડની ટીમ અહીં રમાતી આઇ સીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ મેચના પારંભિક દિવસે વરસાદના કારણે રમત બંધ રાખવામાં આવી ત્યારે પાંચ વિકેટે ૨૦૩ રન બનાવી લીધા હતા. અનુભવી રોઝ ટેલરે અણનમ ૮૬ રનની ઇનિંગ્સ રમીને ન્યૂઝીલેન્ડને ૨૦૦ પ્લસના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ગયા વર્ષે શંકાસ્પદ બોલિંગ એક્શન અંગે ફરિયાદ કરી રહેલા ધનંજયે નવી એક્શન સાથે બોલિંગ કરી હતી અને તેણે છેલ્લી છ મેચમાં ચોથી વખત પાંચ વિકેટ ઝડપી હતી. ધનંજયે ૨૨ ઓવરમાં ૫૭ રન આપીને ન્યૂઝીલેન્ડની તમામ પાંચેય વિકેટ કર્યો હતો. ઓપનર લાથામ (૩૦) તથા



હાંસલ કરી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ રાવલે (૩૩) પ્રથમ વિકેટ માટે દ૪ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય રનની ભાગીદારી નોંધાવી હતી. કર્યો હતો. ઓપનર લાથામ (૩૦) તથા સુકાની કેન વિલિયમ્સન ખાતું ખોલાવ્યા વિના ધનંજયનો ત્રીજો શિકાર બન્યો હતો. ટેલર અને નિકોલ્સે ચોથી વિકેટ માટે ૧૦૦ રનની ભાગીદારી નોંધાવીને ટીમને સંકટમાંથી ઉગારી હતી. ટેલરે ૧૩૧ બોલનો સામનો કરીને છ બાઉન્દ્રી ફટકારી હતી. નિકોલ્સે ૭૮ બોલમાં ૪૨ રન બનાવ્યા હતા.

#### 🛂 સ્કોરબોર્ડ

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવ	- 2세	બોલ	¥	ξ
રાવલ કો. ડી સિલ્લા બો. ધનંજરા	33	63	3	o
લાથામ કો. ડિકવેલા બો. ધનંજય	30		3	0
વિલિયમ્સન કો. કરૂણારને બો. ધનેજય	. O	3	0	0
ટેલર રમતમાં	<b>ζ</b> ξ	939	ξ	0
નિકોત્સ એલબી બો. ધનજય		ac		0
વોટલિંગ એલબી બો. ધનંજય	٩	У	ο	Q
સાન્તેનર રમતમાં	٠	99	<b></b> q	o
એક્સ્ટ્રા : 03કુલ : (દુ૮ ઓવરમાં, પાર	ા વિકે	.os. (Ś	3[g	ડકેટ.
9-58, 5-58, 3-09, 8-909, 4-906.				

૧૪-૦, કુમારા : ૧૦-૧-૩૭-૦, ધનંજય : ૨૨-૨-૫૭-૫, ડી સિલ્વા

૬-૦-૨૦-૦, ઇમ્બુલડેનિયા : ૨૦-૧-૭૩-૦

## THE SANDESH LIMITED

REGD. OFFICE: "SANDESH BHAVAN", LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, P.O. BODAKDEV, AHMEDABAD - 380 054.(GUJ.) (CIN - L22121GJ1943PLC000183)

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS (FOR THE QUARTER ENDED JUNE 30, 2019) AND CONSOLIDATED UNAUDITED
FINANCIAL RESULTS (FOR THE QUARTER ENDED JUNE 30, 2019)
(Rs. In lacs, except earning per share data)

	THANGIAL RESOLIS (FOR THE QUARTER ENDED SORE SO, 2015) (Rs. in Lacs, except earning per snare date								g per snare data)
			STAND	ALONE		CONSOLIDATED			
SR.		QI	JARTER ENDE	D	YEAR ENDED	QUARTER ENDED			YEAR ENDED
NO.	PARTICULARS	June 30, 2019	March 31, 2019	June 30, 2018	March 31, 2019	June 30, 2019	March 31, 2019	June 30, 2018	March 31, 2019
		UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
1.	Total Income from Operations	8994.94	10873.32	12103.31	41687.95	9044.43	10920.70	12162.23	41895.69
2.	Net Profit for the period (before Tax and Exceptional items)	1971.36	3406.78	2650.39	9743.85	2025.69	3424.11	2685.86	9938.77
3.	Net Profit for the period before Tax (after Exceptional items)	1973.75	3388.14	2650.49	9724.99	2028.08	3405.47	2685.96	9919.91
4.	Net Profit for the period after tax (after Exceptional items)	1307.46	2129.92	1719.57	6311.35	1360.88	2143.54	1745.86	6480.88
5.	Total Comprehensive Income for the period [Comprising Profit for	1307.46	2148.95	1719.57	6330.38	1360.88	2162.57	1745.86	6499.70
	the period (after tax) and Other Comprehensive Income (after tax)]								
6.	Paid-up Equity Share Capital	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94
7.	Reserves excluding Revaluation Reserve	-			71587.52		-	-	72283.03
8.	Earnings Per Share (of Rs. 10/- each) (Not Annualised)								
	Basic	17.27	28.14	22.72	83.38	17.98	28.32	23.06	85.62
	Diluted	17.27	28.14	22.72	83.38	17.98	28.32	23.06	85.62

Notes:

i) The above is an extract of the detailed format of Standalone & Consolidated Unudited Financial Results (For The Quarter Ended June 30, 2019) filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and Company's website (www.sandesh.com).

ii) Consolidated Financial Results Includes results of Sandesh Digital Private Limited (A wholly owned subsidiary) and Applewoods Estate Private Limited (Associate).
iii) The above results were reviewed by the Audit Committee and thereafter approved at the meeting of the Board of Directors held on August 14, 2019. The same have also been subject to Limited Review by the Statutory Auditors.

iv) The company expects that finance and trading segments will not meet the criterias as per Ind AS 108 - 'Segment reporting' during the current financial year and there is only one reportable segment namely Media. In view of this, the company has not given segment information.

v) The company has adopted IND AS 116 - 'Leases' which is effective for annual period beginning on or after April 01, 2019. However, As per PARA C3 of IND AS 116 the company has chosen that as a practical expedient not to apply the standard to the contracts that were not previously identified as containing a lease applying IND AS 17. Consequently adoption of this standard does not have any impact on profit for the period.

vi) We declare that review report of company is with unmodified opinion.
vii) Figures for the previous periods have been regrouped / re- arranged, wherever considered necessary.

Parthiv Patel (DIN: 00050211) Managing Director

For and on behalf of the Board

The Sandesh Limited

સંદેશ

Date: August 14, 2019














EMAIL: INVESTORSGRIEVANCE@SANDESH.COM, CONTACT NO. (079) 4000 4000, 4000 4319, FAX NO. (079) 4000 4242, Website: WWW.SANDESH.COM







**FINANCIAL EXPRESS** 



MSME Branch Surat

POSSESSION NOTICE (For Immovable Property)

[Appendix IV under the Act - Rule-8(1)]

The undersigned being the Authorised Officer of Erstwhile Vijaya Bank - Now Bank of BarodaSurat, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of
Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(12)
read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice
dated 01-MAY-2019 calling upon the Borrower & Mortgagor - Mr. Maheshbhai Jasmatbhai
Vekariya (Borrower & Mortgagor) S/o. Mr. Jasmatbhai Haribhai Vekariya, Co-Applicant
Mrs. Artiben Maheshbhai Vekariya - W/o Mr. Maheshbhai Jasmatbhai Vekariya and
Guarantor Mr. Ashok Kumar Chhaganbhai Koladiya - S/o Mr. Chhaganbhai Devrajbhai
Koladiya to repay the amount mentioned in the notice being Rs. 25,54,930.01 (Rupees Twenty
Five Lakhs Fifty Four Thousand Nine Hundred Thirty and Paise Zero One Only) as on 3004-2019 together with further interest thereon with effect from 01-MAY-2019 at contractual rates
together with charges, other monies until payment or realisation and for the due payment or
realization within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown), guarantor and the public in general that the undersigned has taken PHYSICAL POSSESSION of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said [Act] read with Rule 8 of the said rules on this 9th day of August of the year 2019.

The borrower, legal heirs (known - unknown), legal representatives (known - unknown), guarantor and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Erstwhile Vijaya Bank - Now Bank of Baroda - Surat for an amount of Rs. 25,54,930.01 (Rupees Twenty Five Lakhs Fifty Four Thousand Nine Hundred Thirty and Paise Zero One Only) as on 30-04-2019 together with further interest thereon with effect from 01-MAY-2019 at contractual rates together with further Interest, costs, expenses etc. thereon.

The borrower's attention is invited to provision of Sub-Section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

All that piece and parcel of Residential property being at Plot No. 201, Shree Shubh Residency
Survey No.: 192/2, Block No. 204, in the Village of Jokha, Ta.: Kamrej, Surat and Bounded as
North: Passage, South: Society Road, East: Plot No. 200, West: Plot No. 202

Date: 09-08.2019 ERSTWHILE VIJAYA BANK
Place: Surat NOW BANK OF BARODA- SURAT

**∧BC** 

ABC Gas (International) Ltd.

Reg. Off: 1, Mahesh Villa, Worli, Mumbai – 400018, Tel: 24938697/24935508 Fax: 00-91-22-24937758 Email ID: pipedgas@gmail.com Web: www.abogas.co.in

Extract of Statement of Standalone Unaudited Results for the Quarter Ended 30th June,2019

		Year Ended		
Particulars	(Unadited)	(Audited)	(Unadited)	(Audited)
PASCENDARY.	30.06.2019	31.03.2019	30.06.2018	31.03.2019
Total income from operations (Net)	62.60	42.70	16.73	121.72
Net profit / (Loss ) from ordinary activities after tax	1.12	2.56	1.63	15.54
Net Profit / (Loss) for the period before tax (after Extraordinary items)	1.12	2.56	1.63	15.54
Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)	1.12	2.05	1,37	12.78
Total Comprehensive Income for the period (Comprising P/L for the period (after tax) and other Comprehensive Income (after tax))	1.12	2.05	1.37	12.78
Equity Share Capital	198.00	198.00	198.00	198.00
Earning per Share (before extraordinary items ) of Rs.10/- each, not annualised)				
Basic :	0.06	0.10	0.07	0.65
	Total income from operations (Net)  Net profit / (Loss) from ordinary activities after tax  Net Profit / (Loss) for the period before tax (after Extraordinary items)  Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)  Total Comprehensive Income for the period (Comprising P/L for the period (after tax) and other Comprehensive Income (after tax))  Equity Share Capital  Earning per Share (before extraordinary items) of Rs.10/- each, not annualised)	Particulars  (Unadited) 30.06.2019  Total income from operations (Net) Net profit / (Loss ) from ordinary activities after tax Net Profit / (Loss) for the period before tax (after Extraordinary items) Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items) 1.12  Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items) 1.12  Total Comprehensive Income for the period (Comprising P/L for the period (after tax) and other Comprehensive Income (after tax)) 1.12  Equity Share Capital 198.00  Earning per Share (before extraordinary items) of Rs.10/- each, not annualised)	Particulars (Unadited) (Audited) 30.06.2019 31.03.2019  Total income from operations (Net) 62.60 42.70  Net profit / (Loss ) from ordinary activities after tax 1.12 2.56  Net Profit / (Loss) for the period before tax (after Extraordinary items) 1.12 2.56  Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items) 1.12 2.05  Total Comprehensive Income for the period (Comprising P/L for the period (after tax) and other Comprehensive Income (after tax) 1.12 2.05  Equity Share Capital 198.00 198.00  Earning per Share (before extraordinary items ) of Rs.10/- each, not annualised)	Total income from operations (Net)  Net profit / (Loss ) from ordinary activities after tax  Net Profit / (Loss) for the period before tax (after Extraordinary items)  Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)  1.12  2.56  1.63  Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)  1.12  2.56  1.63  Net Profit / (Loss) for the period after tax (after Extraordinary items)  1.12  2.05  1.37  Total Comprehensive Income for the period (Comprising P/L for the period (after tax) and other Comprehensive Income (after tax))  Equity Share Capital  Earning per Share (before extraordinary items) of Rs.10/- each, not annualised)

Notes :-

Diluted :

The above is an extract of the detailed format of Quarter Ended Financial Results filed with the stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements ) Regulation 2015. The full formats of the Quaterly Ended Financial Results are available on the Stock Exchange websites: -www.bseindia.com and on the Company 's website www.abcgasinternational.com.

For on behalf of the Board of Directors. of ABC Gas (International) Ltd.

0.07

0.65

0.10


| Sd/-| Place : Mumbai | S.P. Shorewala | Date : 14/08/2019 | Director (DIN -00088077) GAYATRI TISSUE & PAPERS LIMITED

Regd. Office: 16/137, Siddharthanagar, Road No.5, Near Prabodhan Krida Bhavan,

GAYATRI

(Rs. In Lakhs)

Goregaon (West), Mumbai - 400014. CIN: L51900MH1987PLC042141



**Note:** The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly and Yearly Financial Results are available on the Stock Exchange website: www.bseindia.com and on company's website: www.gtpltd.co.in.

By the Order of the Board For Gayatri Tissue and Papers Limited

Place: Mumbai (P. Maruthi Babu)
Date: 14.08.2019 Executive Director



### **GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS LIMITED**

0.06

P.O. Narmadanagar - 392 015 Dist. Bharuch, Gujarat (India) • Telephone No.: (02642) 247001/2 • Tele Fax No.: (02642) 247084
• E-mail: investor@gnfc.in • Website: www.gnfc.in | www.gnfcneem.in • CIN: L24110GJ1976PLC002903

### EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2019

	Standalone Consolidated Consolidated							dated	(Rs. in Crores)		
Sr.		Quarter Ended			Year Ended				Year Ended		
No.	Particulars	30-06-2019	31-03-2019	30-06-2018	31-03-2019	30-06-2019	31-03-2019	30-06-2018	31-03-2019		
		(Unaudited)	(Audited) (Refer Note 2)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)		
1	Total income from operations	1,209.94	1,430.94	1,604.76	5,896.02	1,209.94	1430.94	1,604.76	5,896.02		
2	Net Profit for the period (before tax, Exceptional and/or Extraordinary items)	66.73	111.00	274.32	819.37	66.73	110.99	274.32	819.36		
3	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	66.73	111.00	274.32	819.37	66.73	110.99	274.32	819.36		
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	66.43	93.60	185.52	741.17	69.44	95.28	187.92	749.74		
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	57.27	66.52	117.31	679.64	60.28	68.20	119.71	688.21		
6	Equity Share Capital	155.42	155.42	155.42	155.42	155,42	155.42	155.42	155.42		
7	Other equity (excluding Revaluation Reserve)				4,841.68				4,909.31		
8	Earnings Per Share (of Rs. 10/- each) (not annualised) (for continuing operations)  (a) Basic: (Rs.)  (b) Diluted: (Rs.)	4.27 4.27	6.02 6.02	11.94 11.94	47.69 47.69	4.47 4.47	6.13 6.13	12.09 12.09	48.24 48.24		

#### Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (http://www.nseindia.com and http://www.bseindia.com) and on the Company's website (http://www.gnfc.in).
- 2 The figures of the preceding quarter ended March 31, 2019 were the balancing figures between audited figures in respect of the full financial year ended March 31, 2019 and the unaudited published year to date figures upto December 31, 2018 being the date of the end of the third quarter of the respective financial year which were subjected to limited review.
- 3 The above standalone and consolidated financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on August 13, 2019. The Statutory Auditors of the Company have carried out a 'Limited Review' of these results.

Place : Gandhinagar Date : August 13, 2019



Scan this QR code to download Results for the Quarter Ended 30\* June, 2019 For and on behalf of the Board of Directors,

M S Dagur

Managing Director

# THE SANDESH LIMITED



REGD. OFFICE: "SANDESH BHAVAN", LAD SOCIETY ROAD, B/H. VASTRAPUR GAM, P.O. BODAKDEV, AHMEDABAD - 380 054.(GUJ.) | (CIN - L22121GJ1943PLC000183)

## EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS (FOR THE QUARTER ENDED JUNE 30, 2019) AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS (FOR THE QUARTER ENDED JUNE 30, 2019) (Rs. In Lacs, except earning per share data)

		Sandalandid, kalikushida dalahari iku dani dalah dani dalah dani dalah dani dalah dalah dalah dalah dalah dalah				(ns. in caes, except carming per snare data)			
		STANDALONE				CONSOLIDATED			
SR.		QU	JARTER END	D	YEAR ENDED	Q	UARTER ENDE	D YEAR ENDED	
NO.	PARTIEITARS	June 30, 2019	March 31, 2019	June 30, 2018	March 31, 2019	June 30, 2019	March 31, 2019	June 30, 2018	March 31, 2019
		UNAUDITED	AUDITED	UNAUDITED	AUDITED	UNAUDITED	UNAUDITED	UNAUDITED	AUDITED
1.	Total Income from Operations	8994.94	10873.32	12103.31	41687.95	9044.43	10920.70	12162.23	41895.69
2.	Net Profit for the period (before Tax and Exceptional items)	1971.36	3406.78	2650.39	9743.85	2025.69	3424.11	2685.86	9938.77
3.	Net Profit for the period before Tax (after Exceptional items)	1973.75	3388.14	2650.49	9724.99	2028.08	3405.47	2685.96	9919.91
4.	Net Profit for the period after tax (after Exceptional items)	1307.46	2129.92	1719.57	6311.35	1360.88	2143.54	1745.86	6480.88
5.	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1307.46	2148.95	1719.57	6330.38	1360.88	2162.57	1745.86	6499.70
6.	Paid-up Equity Share Capital	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94	756.94
7.	Reserves excluding Revaluation Reserve				71587.52				72283.03
8.	Earnings Per Share (of Rs. 10/- each) (Not Annualised)								
	Basic	17.27	28.14	22.72	83.38	17.98	28.32	23.06	85.62
	Diluted	17.27	28.14	22.72	83.38	17.98	28.32	23.06	85.62

### Notes :

Place: Ahmedabad

Date : August 14, 2019

- i) The above is an extract of the detailed format of Standalone & Consolidated Unudited Financial Results (For The Quarter Ended June 30, 2019) filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and Company's website (www.sandesh.com).
- Consolidated Financial Results Includes results of Sandesh Digital Private Limited (A wholly owned subsidiary) and Applewoods Estate Private Limited (Associate).
- iii) The above results were reviewed by the Audit Committee and thereafter approved at the meeting of the Board of Directors held on August 14, 2019. The same have also been subject to Limited Review by the Statutory Auditors.
- iv) The company expects that finance and trading segments will not meet the criterias as per Ind AS 108 'Segment reporting' during the current financial year and there is only one reportable segment namely Media. In view of this, the company has not given segment information.
- v) The company has adopted IND AS 116 'Leases' which is effective for annual period beginning on or after April 01, 2019. However, As per PARA C3 of IND AS 116 the company has chosen that as a practical expedient not to apply the standard to the contracts that were not previously identified as containing a lease applying IND AS 17. Consequently adoption of this standard does not have any impact on profit for the period.
- vi) We declare that review report of company is with unmodified opinion.
- vii) Figures for the previous periods have been regrouped / re- arranged, wherever considered necessary.

For and on behalf of the Board The Sandesh Limited

> Parthiv Patel (DIN: 00050211) Managing Director
















EMAIL: INVESTORSGRIEVANCE@SANDESH.COM, CONTACT NO. (079) 4000 4000, 4000 4319, FAX NO. (079) 4000 4242, Website: WWW.SANDESH.COM